

રૂ.૧૦૦/- ના સ્ટેમ્પ ઉપર નોટરી મારફતે નીચે દર્શાવેલ નમુના મુજબ સોગંદનામુ કરી અલગથી રજુ કરવાનું રહેશે સોગંદનામામાં કોઈપણ પ્રકારનો ફેરફાર ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. ફેરફારવાળા સોગંદનામાના કિસ્સામાં કરેલ અરજી રદ કરવામાં આવશે.)

પરિશિષ્ટ-૩

સોગંદનામું


આથી હું નીચે સહી કરનાર શ્રી/ શ્રીમતી/ કું. ઉંમર
વર્ષ આશરે વ્યવસાય. રહેવાસી.
..... તા.જી. ગાંધીનગર. પીન કોડ નં.
મો.નં.....

- આથી આ સોગંદનામા દ્વારા નીચે પ્રમાણે અંતઃકરણપૂર્વક જાહેર કરું છું અને પ્રતિજ્ઞાપૂર્વક જણાવું છું. કે,
- (૧) ગાંધીનગર મહાનગરપાલિકા તથા ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં મારા કે/ મારી પત્ની/ પતિ કે કુટુંબના કોઈપણ સભ્યના નામે રહેણાંકનું મકાન કે ફ્લેટ સરકારી કાયદા હેઠળ રચાયેલ કોઈ કો.ઓ. સોસાયટીમાં કે અન્ય રીતે ભાડા ખરીદ યોજના હેઠળ માલિકીનું મકાન કે ફ્લેટ નથી.
 - (૨) મારી તથા મારા કુટુંબની સને ૨૦૧૭-૨૦૧૮ ની બધા સાધનોમાંથી મળી કુલ વાર્ષિક આવક રૂ.....છે.
 - (૩) મારો અનુસૂચિત જાતી/ અનુસૂચિત જનજાતી/ બક્ષીપંચ/ ડીફેન્સ/ દિવ્યાંગ/ અન્ય કેટેગરીમાં સમાવેશ થાય છે અને હું અનુસૂચિત જાતી/ અનુસૂચિત જનજાતી/ બક્ષીપંચ/ ડીફેન્સ/ દિવ્યાંગ/ અન્ય કેટેગરીમાં અરજી કરું છું.ગુડા તરફથી આર્થિક રીતે નબળા વર્ગના(E.W.S.-II) લોકો માટે ફાળવવામાં આવનાર મકાનો અંગે જે નીતિ નિયમો નક્કી કરવામાં આવ્યા છે તે મને બંધનકર્તા છે અને ભવિષ્યમાં તેમાં જે કોઈ ફેરફારો કરવામાં આવશે તે પણ મને બંધનકર્તા રહેશે.
 - (૪) ગુડા તરફથી મને જે મકાન ફાળવવામાં આવશે તેની કિંમતને લગતાં નિયત હપ્તાની રકમ ઇંડ કે ઇંડનીય વ્યાજ, વેરો કે ઈતર રકમ રજીસ્ટ્રેશનનો ખર્ચ/રકમ તે હું સત્તામંડળને અથવા સત્તામંડળ નક્કી કરે તે અધિકૃત સંસ્થાને નિયત સમયમાં ભરવા બંધાઉં છું.
 - (૫) આર્થિક રીતે નબળા વર્ગના (E.W.S.-II) લોકોની આ યોજના હેઠળ રચવામાં આવતા એસોશીએશનનો હું સભ્ય થવા સંમત થાઉં છું અને તેના નીતિ નિયમોનું પાલન કરીશ.
 - (૬) E.W.S.-II આવાસ યોજનાના મારા અરજીપત્રકમાં દર્શાવ્યા મુજબ હું ભાડે રહું છું/ માતા-પિતા સાથે રહું છું તે વિગતો ખરી છે.
 - (૭) હું ભારતભરમાં મારી માલિકીનું પાકું મકાન/ફ્લેટ કોઈ જગ્યાએ ધરાવતો/ધરાવતી નથી.
 - (૮) મેં સરકારી કે અર્ધ સરકારી સંસ્થા દ્વારા આપવામાં આવેલ રહેણાંકના મકાનનો લાભ અગાઉ મેળવેલ નથી.
 - (૯) અમોને ફાળવવામાં આવેલ મકાન અન્ય કોઈપણ વ્યક્તિને ૭ વર્ષ સુધી વેચાણ, ગીરો, બાનાખાત, પાવર ઓફ એટની, ભાડે અથવા અન્ય કોઈપણ પ્રકારે અમો તબદીલ કરીશું નહીં કે મકાનનો ભોગવટો કામચલાઉ કે કાયમી રીતે અન્યને સુપ્રત કરીશું નહીં. તેમજ તેમા કસુરવાર થયે અમોને ફાળવવામાં આવેલ મકાનનો કબજો પરત લઈ અમોને ફાળવેલ મકાન/ ફ્લેટની ફાળવણી રદ કરવાની તથા અમો દ્વારા ભરપાઈ કરવામાં આવેલ તમામ નાણાં જપ્ત કરી ફોજદારી/ કાનુની કાર્યવાહી કરવાની સંપૂર્ણ સત્તા સત્તામંડળને છે જે અમો જાણીએ તથા કબુલીએ છીએ.
 - (૧૦) મને ફાળવવામાં આવેલ મકાનનો ઉપયોગ માત્ર રહેણાંકના હેતુ માટે જ કરીશ. અન્ય ઉપયોગ કરીશ નહિ તેની બાંહેધરી આપું છું.
 - (૧૧) જો મને ડ્રોમાં મકાન ફાળવવામાં આવે અને પછી જો હું સભ્ય પદ રદ કરવા અરજી કરું તો ભવિષ્યમાં થનાર આવાસ

યોજનાના ડ્રોમાં મારો હક્ક દાવો રહેશે નહિ તેની ખાતરી આપું છું.

- (૧૨) સદરહુ યોજના હેઠળ મને ફાળવવામાં આવેલ મકાન સંબંધે ગુડા ના વખતો વખતના પ્રધાન મંત્રી આવાસ યોજના સંબંધી નીતિ નિયમોનું પાલન કરવા હું બંધાયેલ છું. ગુડા દ્વારા નક્કી કરેલ નીતિ- નિયમોનું હું ઉલ્લંઘન કરીશ, તો ગુડા દ્વારા જે કોઈ કાર્યવાહી કરવામાં આવશે/નિર્ણય લેવામાં આવશે તે મને કબુલ/મંજુર અને બંધનકર્તા રહેશે.
- (૧૩) ઉપરોક્ત વિગતો પૈકી કોઈ વિગતો ખોટી ઠરે તો ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ જે કોઈ નિર્ણય કરશે તે મને કબુલ મંજુર અને બંધનકર્તા રહેશે.

ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળને ઉપર જણાવેલ હકીકત સંપૂર્ણ સમજદારી પૂર્વક કોઈ પણ જાતના દબાણ વગર સભાન અવસ્થામાં તથા શુદ્ધ બુધ્ધિથી તથા મારી જાણ અને માન્યતા પ્રમાણે સાચી/ ખરી અને કાયદેસરની છે. જે મને તથા મારા વંશવાલી વારસોને પણ બંધનકર્તા રહેશે. ખોટું સોંઘનામું કરવું એ ગુનો બને છે જેની મને જાણ છે.



નામ :-

સહી :-

સ્થળ :-

તારીખ :-